

પ્રતિ,
તંત્રીશ્રી,
દૈનિક.....

તા.૨જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન કરાયું.

માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અર્બન ફોરેસ્ટને “રામ વન” નામકરણ જાહેર કર્યું.

રાજ્યમાં કુલ ૧૦ કરોડ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવશે :

- માન. મુખ્યમંત્રીશ્રી

ભૂતકાળમાં વનમહોત્સવ ગાંધીનગર ખાતે જ યોજાતો, હાલના માન.વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૪માં રાજ્યના જિલ્લાઓમાં ઉજવણીની શરૂઆત કરાવેલ

- વનમંત્રી, ગણપતભાઈ વસાવા

રાજ્યમાં ૨૦મુ સાંકૃતિક વન રાજકોટમાં બની રહેલ છે.

- રાજ્યકક્ષાના વનમંત્રી, રમણલાલ પાટકર

રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા અર્થે કાર્બન ઘટાડવાની કાર્યવાહીના અનુસંધાને એવોર્ડ પણ મળેલા છે.

- મેયર, બિનાબેન આચાર્ય

રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૨જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના જન્મદિને અર્બન ફોરેસ્ટ, આજીડેમ પાછળ સવારના ૧૦:૩૦ કલાકે, રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન યોજાયું . જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકર જોડાયેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરયાના પ્રભારી અંજલીબેન રૂપાણી, વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, કલેક્ટર અને વનીકરણ સમિતિ ચેરમેન રેખ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, પૂર્વ મેયર ડૉ. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ, ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ઇંડક અજયભાઈ પરમાર, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર તેમજ કોર્પોરેટરશ્રીઓ મનીષભાઈ રાડીયા, પરેશભાઈ પીપળીયા, અનિલભાઈ રાહોડ, બાબુભાઈ આહીર, અશ્વિનભાઈ ભોરણીયા, નીતિનભાઈ રામાણી, મુકેશભાઈ રાદડિયા, જ્યોત્સનાબેન ટીલાળા, જાગૃતિબેન ઘાડિયા, ડૉ. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, શિલ્પાબેન જાવિયા, જયાબેન ડાંગર, અનીતાબેન ગોસ્વામી તેમજ કોર્પોરેશનના અને વનવિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે સંવેદનશીલ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ સૌ પ્રથમ ૨૦માં સાંસ્કૃતિક વનના ઉદઘાટન પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ભારતના વનમંત્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવ શરૂ કરાવેલ. ભૂતકાળમાં રાજ્યમાં ગાંધીનગર ખાતે વન મહોત્સવ યોજાતો. ૨૦૦૪માં રાજ્યના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય કક્ષાના જુદા જુદા જીલ્લાઓમાં વન મહોત્સવનો શુભારંભ કરાવેલ એ પરંપરા રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહેલ છે. ધનિષ્ઠ વૃક્ષારોપણ સાથે સાથે રાજ્યમાં સાંસ્કૃતિક વનો બને તે માટે સરકાર કટીબદ્ધ છે. સૌ પ્રથમ “માં અંબાજી”ના આશીર્વાદથી અંબાજી ખાતે પ્રથમ સાંસ્કૃતિક વનશરૂ કરાયેલ. આજે રાજકોટ શહેરમાં અર્બન ફોરેસ્ટ ખાતે ૨૦મું સાંસ્કૃતિક વન ઉભું કરવાનું હાથ ધરવામાં આવેલ છે. અર્બન ફોરેસ્ટમાં ૧૫૭ એકર વિશાળ જગ્યામાં શહેરનું એક વન વહેલી તકે ઉભું કરવા મહાનગરપાલિકા અને વનવિભાગને જણાવેલ. વિશેષમાં રાજ્યકક્ષાના વન મહોત્સવ અનુસંધાને ૩૩ જિલ્લા, ૨૫૦ તાલુકા, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને ૫૧૦૦ ગામોમાં ૧૦ કરોડ રોપાનું વિતરણ કરવામાં આવશે.

વિશેષમાં માન. મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ ગયા છીએ ત્યારે રાજ્ય પ્રદુષણ મુક્ત, શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને પર્યાવરણ માટે આગળ લઈ જવા કટીબદ્ધ છે. કોરોના વાઈરસમાં કોરોનાના દર્દીને ઓક્સિજન ઘટી જાય છે ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહે છે. પ્રાણવાયુની તો જગત આખાને જરૂરિયાત હોઈ છે અને વૃક્ષો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. મારા જન્મદિને માનવજાતના કલ્યાણ માટે કુદરતી ઓક્સિજન વધુને વધુ મળે તે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. “વનસ્પતિમાં પણ જીવ છે”, “છોડમાં રણછોડ છે”, “પીપળામાં પરષોતમમાં દર્શન છે” આપણા ભારત દેશની સંસ્કૃતિમાં આ એક ભવ્ય વારસો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજના આ અવસરે હું આ વનને “શ્રી રામવન” નામકરણ કરું છું. અંતમાં, તેઓએ જણાવેલ કે, આપણું શહેર ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ બને તે દિશામાં આપણે સૌ આગળ વધીએ.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ જણાવેલ કે, જીવદયા અને વૃક્ષપ્રેમી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાતનું ૬ કરોડજનતા વતી શુભેચ્છા પાઠવું છું. અગાઉ રાજ્યમાં વનમહોત્સવ ગાંધીનગર ખાતે જ યોજાતો. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૪માં રાજ્યના જિલ્લાઓમાં ઉજવણીની શરૂઆત કરાવેલ. તે પરંપરા મુજબ રાજ્ય આગળ વધી રહેલ છે. આખું વિશ્વ ગોબલ વોર્મિંગથી ચિંતિત છે ત્યારે રાજ્ય સરકાર અ પડકારને પહોંચી વળવા અનેક પ્રકારના પગલા લઈ રહી છે, માન. મુખ્યમંત્રીશ્રીના પ્રયત્નોથી રાજ્ય વનીકરણ દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીની સ્વપન છે “ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત”. આ સંકલ્પને સાર્થક કરવા રાજ્ય કટીબદ્ધ છે.

વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરએ જણાવેલ કે, માનવજીવન માટે ૩૩% વૃક્ષો જરૂરી છે. માનવજીવનમાં વૃક્ષોનો એક અમુલ્ય હિસ્સો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટમાં સાંસ્કૃતિક વનનું નિર્માણની સાથેસાથે ઐતિહાસિક પ્રવેશ દ્વાર, સાઈકલ ટ્રેક, પક્ષીઓ માટે અનુરૂપ એવા વૃક્ષો તેમજ ઔષધીવન વિગેરેની સુવિધાઓ સાથે બાળકો થી વૃદ્ધો સુધી નયનરમ્ય બનશે. રાજ્યમાં ૨૦મું સાંસ્કૃતિક વન બની રહેલ છે તેમ તેઓએ અંતમાં જણાવેલ.

મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજ્ય ગ્રીન બેલ્ટ બનાવવા કટીબદ્ધ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં આગળ વધી રહી છે, આજરોજ અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ , સાંસ્કૃતિક વનની સાથેસાથે લોકો પોતાના ઘરઆંગણે પણ વૃક્ષો વાવે તે માટે “ગો ગ્રીન રથ”નો શુભારંભ થઈ રહ્યો છે. આ રથના માધ્યમથી ડોર ટુ ડોર ટ્રીગાર્ડ સાથે વૃક્ષો વવાશે અને તેની જાળવણી લોકોએ કરવાની રહેશે, રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી કોરોના સામેના જંગમાં દિવસ-રાત જોયા વગર સતત કામ કરી રહ્યા છે અને જનહિતમાં અનેક નિર્ણયો કરેલ છે. આજે માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજકોટના નગરજનોવતી શુભેચ્છા પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં કાર્બન ઘટાડવા માટે અનેક પગલાઓ લીધેલ છે. જેના અનુસંધાને એવોર્ડ પણ મળેલ છે. વિશેષમાં આજરોજ સંજીવની રથ પ્રસ્થાન કરાવેલ છે તેના માધ્યમથી હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓના સવાસ્થ્યના ચકાસણી અને તબીબી માર્ગદર્શન મળી રહેશે.

કાર્યક્રમના પ્રારંભમાં વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વન મહોત્સવની માહિતી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. જ્યારે સમારોહના અંતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આભારવિધિ કરેલ. ત્યારબાદ માન. મુખ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા “ગો ગ્રીન રથ”, “સંજીવની રથ” અને “ધનવંતરી રથ”નું પ્રસ્થાન કરાવેલ અને સૌ મહાનુભાવોના નામની રાશી પ્રમાણેના વૃક્ષો વાવવામાં આવેલ.

શહેરમાં હરિયાળીનો વ્યાપ વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કામગીરી હાથ ધરી રહી છે. રજી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસે તેઓશ્રીના વરદ હસ્તે અર્બન ફોરેસ્ટનો શુભારંભ કરવામાં આવેલ. અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ ૧૫૬.૧૬ એકર જમીન સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવેલ છે. જે પૈકી, ૪૭ એકર ખુલ્લી જમીનમાં પ્રારંભિક તબક્કે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિકના વનના નિર્માણની કામગીરી હાથ ધરાશે. જેમાં “તીર્થકર વન”, નક્ષત્ર વન, અને રાશી વન” માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ “ઔષધિય વન”ના ભાગો વિકસિત વન વિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. આ જગ્યામાં ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુળતા ધરાવતા અંદાજ જુદી જુદી ૫૫ થી ૬૦ વિવિધ જાતના અંદાજ ૫૫૦૦૦થી વધુ જટલી સંખ્યામાં ઓછા નીલાવ ખર્ચ વાળા બહુ-વર્ષીય ટ્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ-પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવશે.

ગત તા.૧૪/૦૭/૨૦૨૦ના રોજ માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે રૂ.૭.૬૯ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

- અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ
 - એડમીન ઓફીસ
 - સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો
 - કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ
 - પાણીના પરબ, ટોઇલેટ બ્લોક્સ
 - બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એકઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ
 - જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે
 - ઓપન એર એમ્પ્લી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ
 - રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ
 - આકર્ષક એન્ટ્રી ગેઈટ
 - જુદા જુદા પ્રકારના પ્લાન્ટેશન માટે બ્લોક્સ
 - વિશાળ એરિયામાં પાર્કિંગ
- વિગેરે સુવિધા કરાશે.

આ ઉપરાંત આગામી દિવસોમાં ખડકાળ ભાગોએ “બહુહેતુક લેન્ડ સ્કેપિંગ & ગાર્ડનિંગ” કરી ટુકા ભવિષ્યમાં લોક સુવિધાઓ અપાવના આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત બહુ હેતુક આયામની પ્રતીતિ કરાવતા સ્કલ્પચર્સ, એન્ટ્રન્સ ગેઈટ્સ, બેઠક વ્યવસ્થા, ગજબોસ વિગેરે સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

(પી.એ.ટુ મેયર)